

પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિચી....અને આજે આપણે વાત કરીશું 'A sticky situation' એટલે 'ચોટેલી પરિસ્થિતિ વિશે.

મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં 'A sticky situation' વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી... હું તમને સમજાવું.

રોબ ફેફેઈને જણાવે છે કે કામ ઉપર આવતી વખતે એની સાથે એવી ઘટના બની કે એ 'a sticky situation' જેવી સ્થિતિમાં મૂકાઈ ગયો છે. મિત્રો, શું તમને કોઈ અંદાજ ખરો કે રોબની સાથે શું થયું હશે? રોબ જે સ્થિતિમાં મૂકાઈ ગયો શું એ હકારાત્મક છે કે નકારાત્મક? ચાલો જાણીએ...

**Rob**

(Door opens) Oh hi Feifei... you couldn't lend me £10, could you?

**Feifei**

Rob! You're supposed to be presenting this programme. Anyway, what do you need £10 for? And what's that stuff all over your clothes?

**Rob**

Well, I was running to get to the studio and I bumped into a woman.

**Feifei**

Right... So, what do you need £10 for?

**Rob**

Well, you see, she dropped a big box she was carrying and said I would have to pay for the damage – and if I didn't, her daughter would be really upset!

પ્રેઝન્ટર

રોબ સ્ટૂડિયો ની બહાર ઉભી રહેલી મહિલા સાથે 'bumped into' થઈ ગયો. મિત્રો, ગુજરાતીમાં 'bumped

into' નો અર્થ થાય છે કોઈક સાથે ટક્કર થવી. bumped into' થવાનાં કારણે રોબને 'pay for the damage' કરવું છે અને એટલાં માટે એ ફ્રેફ્રેઈ પાસેથી 10 પાઉન્ડ ઉધાર માંગી રહ્યો છે. ગુજરાતીમાં 'pay for the damage' એટલે જે નુકશાન થયું એના પેટે પૈસા ચૂકવવા. ફ્રેફ્રેઈ શું કરે છે એ જાણવા આગળ સાંભળો..

### Feifei

Oh! Rob, you are in 'a sticky situation'.

### Rob

A sticky situation? Yes, that's true. You mean I'm in a situation that is difficult to get out of?

### Feifei

Exactly! Rob, here's £10 - now you can go and un-stick the situation!

### Rob

Thanks Feifei.

### પ્રેઝન્ટર

ફ્રેફ્રેઈ રોબને 10 પાઉન્ડ આપે છે જેથી એ 'sticky situation' માંથી બહાર આવે.

મિત્રો, 'sticky' નો અર્થ થાય છે ચોંટે એવી અને 'situation' એટલે પરિસ્થિતિ. 'sticky situation' એટલે મુશ્કેલ, મૂઝવનારી અથવા સંવેદનશીલ સ્થિતિ જે હલ કરવી ઘણી અઘરી છે. 'situation' એટલે પરિસ્થિતિ 'sticky' એટલે કે ચોંટે છે કારણકે તમે એમાં ફસાયેલા છો. રોબના કિસ્સામાં તો એ પૈસા આપીને બચી ગયો પણ દરેક વખતે એવું થતું નથી. કોઈક વખત માફી માંગવી પડે છે, કોઈક સાથે મુશ્કેલ ગણાય એવા સંવાદમાં કે વાદ-વિવાદમાં જોડાવું પડે છે અથવા કોઈકને મદદ માટે કહેવું પડે છે.

કોઈક 'sticky situation' માંથી નિકળવું એકદમ અસંભવ હોય છે. આ અભિવ્યક્તિ ગણી વખત ક્રિયાપદ 'to be' અથવા 'to be in' સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે 'It's a sticky situation' અથવા 'He's in a sticky situation.' તમે ક્રિયાપદ 'get into' અને 'get out of' નો પણ ઉપયોગ કરી શકો છો.

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ..

### Examples

I'm in a sticky situation – I've got to catch the train to be at work for a meeting but I lost my wallet. To get out of the situation I need someone to lend me enough money for the train.

It was a sticky situation – both drivers said it was the other’s fault and neither side would agree on who caused the accident.

Sarah has got into a sticky situation: she said she'd go to the cinema with Pete but she's also promised to go for a drink with John. She doesn't want to disappoint either of them but she has to choose one.

**Feifei**

So a sticky situation is a difficult, awkward or sensitive situation. (Door opens again) Ah, Rob, you're back...

**Rob**

...yes. She's happy now and is going back to the bakery again.

**Feifei**

The bakery? Why? What was in the box she was carrying?

**Rob**

It was a big birthday cake for her daughter.

**Feifei**

Oh no - you were in a sticky situation in more ways than one!

**Rob**

I suppose I was.

**Both**

Bye.

પ્રેઝન્ટર

આશા રાખીએ રોબ ફરીથી 'sticky situations' માં નહીં ફસાઈ જાય. તમારા વિશે જણાવો મિત્રો? શું તમે ક્યારેય 'sticky situations' નો અનુભવ કર્યો છે? શું થયું હતું? તમે કેવી રીતે એવી પરિસ્થિતિમાં આવી ગયા અને એમાંથી બહાર આવવા શું કર્યું?

આવાં જ બીજા રસપ્રદ ટોપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી Bye!